

ત્વરિત જાહેરાત માટે

**સીટી ઓફ બ્રેમ્પટન 2022 પ્રોવિન્સિયલ ઇલેક્શન કેન્ડિડેટ્સની હિમાયત કરીને  
મુખ્ય અગ્રતાઓને આગળ વધારવા ઇચ્છે છે**

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (મે 25, 2022) – જૂન 2 નાં રોજ થનારા પ્રોવિન્સિયલ ઇલેક્શન પહેલાં, સીટી ઓફ બ્રેમ્પટનની ગવર્મેન્ટ રિલેશન્સ ટીમ અને કાઉન્સિલ સભ્યો સીટીની મુખ્ય અગ્રતાઓને આગળ વધારવામાં મદદરૂપ થવા સતત હિમાયત કરી રહ્યાં છે.

સીટીની ટોચની અગ્રતાઓમાં આ બાબતો સામેલ છે:

- મેઈન સ્ટ્રીટથી બ્રેમ્પટન GO સુધી લાઈટ રેઈલ ટ્રાન્ઝિટ (LRT) માટે ભંડોળ ઊભું કરવું
- ક્વીન સ્ટ્રીટ-લાઈવે 7 બસ રેપિડ ટ્રાન્ઝિટ (BRT) અને પ્રાદેશિક જોડાણો
- ઈ-બસ કાફલા માટે ત્રીજી ટ્રાન્ઝિટ સગવડનું ઇલેક્ટ્રિકિફિકેશન કરવું
- રિવરવોક પ્રોજેક્ટ – લાંબા-ગાળા સુધી પૂરના જોખમના ઉકેલો લાવવા
- બ્રેમ્પટનમાં વધારે સારી આરોગ્ય સંભાળ નિર્માણ પ્રત્યે કટિબદ્ધ રહેવું (પીલ મેમોરિયલનું વિસ્તરણ /ત્રીજી હોસ્પિટલ /કિન્સર સંભાળ)

ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયો સીટી માટે મહત્વના ભાગીદાર છે. પ્રોવિન્સ પાસેથી મળેલું ભંડોળ સર્વગ્રાહી, આરોગ્યપ્રદ અને ટકાઉ બ્રેમ્પટનના નિર્માણમાં મદદરૂપ થાય છે, અને રહેવાસીઓના જીવનની ગુણવત્તા સુધારે છે. સીટીની પ્રોવિન્સિયલ અગ્રતાઓ વિશે વધુ માહિતી [અહીં](#) વાંચો.

2022 નું ઓન્ટેરિયો પ્રોવિન્સિયલ ઇલેક્શન જૂન 2, 2022 નાં રોજ થશે. રહેવાસીઓ મતદાન પર વધુ માહિતી [અહીં](#) જોઈ શકે છે.

**અવતરણો (ક્વોટ્સ):**

“બ્રેમ્પટન કેનેડાના સૌથી ઝડપથી-વિકસી રહેલા મોટા શહેરોમાંનું એક છે, અને સીટી કાઉન્સિલ ટ્રાન્ઝિટનું વિસ્તરણ કરવા, ટકાઉ માળખાગત સગવડમાં રોકાણ કરવા અને હોસ્પિટલમાં વધારે પડતી ભીડ અને આપણાં રહેવાસીઓ માટે હોલવે મેડિસિન સમાપ્ત કરવા કટિબદ્ધ છે. હું આપણાં સમુદાયમાં બધાં પાત્રતા ધરાવતા મતદાતાઓને જૂન 2 નાં રોજ 2022 પ્રોવિન્સિયલ ઇલેક્શનમાં પોતાનો મત આપવા વિનંતી કરું છું, અને તેઓને અમારી ટોચની અગ્રતાઓ અને ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોની ભંડોળ જરૂરિયાતો વિશે વધુ શીખવા પ્રોત્સાહિત કરું છું. અમે સફળ ઉમેદવારો સાથે કામ કરવાની આશા રાખીએ છીએ.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“સીટી ઓફ બ્રેમ્પટનની ગવર્મેન્ટ રિલેશન્સ ટીમ આપણાં રહેવાસીઓ માટે જીવનની ગુણવત્તા સુધારવા ગવર્મેન્ટ ઓફ ઓન્ટેરિયોમાં અમારા ભાગીદારો સાથે કામ કરવા કટિબદ્ધ છે. અમે પ્રોવિન્સની સાથે સીટીને સર્વગ્રાહી, આરોગ્યપ્રદ અને ટકાઉ બનાવવાનું ચાલુ રાખવા આશાવાદી છીએ.”

- પૉલ મોરિસન (Paul Morrison), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ



## Media Release

કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca)

### મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

[multiculturalmedia@brampton.ca](mailto:multiculturalmedia@brampton.ca)